



## પ્રકરણ - ૭

### સ્તનપાન



#### વિષયસૂચિ :

- ૧.૦ બોટલનું દૂધ કે ડબાના આહાર બાળકને નુકસાન કરે છે.
- ૨.૦ સ્તનપાન કરાવવાની રીત
- ૩.૦ માતાને આપવાના ખોરાક માટે સલાહ
- ૪.૦ માતાને કામે જવાનું હોય ત્યારે

- ૫.૦ ધાવણ અંગે સાચું-ખોદું સમજીએ
- ૫.૧ ધાવણ અંગેની કેટલીક માન્યતાઓ
- ૫.૨ ધાવણ અંગેની સામાન્ય સમસ્યાઓ
- ૬.૦ ખાસ પરિસ્થિતિઓ
- ૭.૦ પરિવર્તન માટે પ્રયાસ

તમે ઈચ્છો ત્યાં સુધી તમારા બાળકને ધાવણ આપી શકો છો. તેનાથી તમને કોઈ તકલીફ થતી નથી. દેરેક માતાને કુદૃતી રીતે ધાવણ આવે જ છે. કોઈ કોઈ માતાને કહાચ તકલીફ થાય તો પણ આત્મવિશ્વાસ અને ધીરજથી ઉપાય કરશો તો ધાવણ આવશે જ. આ પ્રકરણમાં સ્તનપાન વિશે ઉપયોગી માહિતી આપેલ છે.

## સ્તનપાન

બાળકના પોષણ માટે સ્તનપાન (ધાવણ આપવું) એ સૌથી જૂની અને સૌથી વધુ સ્વાસ્થ્યપ્રદ પદ્ધતિ છે.

- \* દ્વેક બાળક માટે માતાનું દૂધ (ધાવણ) એક માત્ર પૂર્ણ આહાર છે.
- \* તેનાથી બાળક મજબૂત અને તંદુરસ્ત બને છે.
- \* સ્તનપાન કરાવવાથી માતાને સુવાવહ પછી લોહી પડતું બંધ થાય છે.
- \* સ્તનપાન કરાવવાથી બાળકને ઝાડા અને ન્યુમોનિયા જેવી ગંભીર બિમારીઓથી રક્ષણ મળે છે.
- \* સ્તનપાન કરાવવાથી માતા અને બાળક બંને વધુ નિકટતા અને સલામતી અનુભવે છે.
- \* કેટલીક સ્ત્રીઓમાં સ્તનપાનના સમય દરમ્યાન ગર્ભ રહેતો નથી.



બહારનું દૂધ કે ડબાના દૂધ પર ખર્ચ કરવાને બદલે બાળકને શક્યઆતની જંગીના ૪-૬ માસ ફક્ત ધાવણ ઉપર જ રાખવાથી તેનું સ્વાસ્થ્ય વધુ સારુ બને છે.

### ૧.૦ બોટલનું દૂધ કે ડબાના આહાર બાળકને નુકસાન કરે છે



જે કંપનીઓ ફૂતિમ દૂધ કે દૂધના પાવડર બનાવે છે તેઓ પોતાના વ્યાપારિક નફા માટે કામ કરે છે. તેથી બજલરમાં મળતા ડબાના દૂધ અત્યંત મૌંઘા હોય છે. બાળકની જરૂરિયાત જેટલું દૂધ આપવા માટે ધણા ડબા દૂધ ખરીદવું પડે છે. જે સામાન્ય રીતે મુશ્કેલ છે. તેથી ડબાના દૂધ પર ઉછરતું બાળક પૂરતું પોષણ મેળવી શકતું નથી. બોટલનું દૂધ પીવડાવવાનું કામ ખૂબ કડાકૂટવાનું છે. તેથી સાધન સંપન્ન કુદુંબમાં પણ બાળકને આ રીતે રાખવું હિતાવહ નથી. બહારના દૂધના ડબાઓ કે પ્રાણીઓના દૂધથી બાળકને રોગ સામે રક્ષણ મળતું નથી. જ્યારે માતાના દૂધમાં રહેલા રોગરક્ષકતત્વો બાળકને ઝાડા, ન્યુમોનિયાથી રક્ષણ આપે છે.

બોટલથી આપવામાં આવતું દૂધ દર વખતે ઉકાળેલા બોટલ અને નીપલ વડે આપવું. દૂધ પણ દર વખતે ઉકાળીને આપવું જોઈએ. બોટલ, નિપલના રબરમાં જાડાના જવાણું રહે છે. તેથી બાળકને દૂધની સાથે સાથે તમે રોગાણું પણ પીવડાવો છો. આથી બાળક વધુને વધુ બિમાર થવાની શક્યતા છે.



## ૨.૦ સ્તનપાન કરાવવાની રીત :

● બાળકને ભૂખ લાગે, શરીરમાં તકલીફ હોય, કે તરસ લાગે ત્યારે તેને ધાવવાનું ગમે છે. બાળક રડે ત્યારે તમે જો તેનું કારણ જાણી ન શકો તો ધાવણ આપવામાં કોઈ વાંધો નથી. તેથી બાળક શાંત થઈ જશે. છતાં લાંબે ગાળે, બાળક જેટલીવાર માંગે તેટલી વાર ધાવણ આપવાની ટેવને લીધે માતાને ઘણીવાર મુશ્કેલી પડે છે.

નવજાત શિશુને જન્મભાદ માતાનો થાક ઉત્તરે એટલે તરત જ એકાદ કલાકની અંદર જ સ્તનપાન શક્ષ કરાવો. સુવાવડ બાદનું પ્રથમ ચીકણું-જાડું દૂધ (કોલોસ્ટ્રમ) બાળકને રક્ષણ આપનાનું અને વધુ પોષક હોય છે. તેને ફેંકી ઢેવું નહીં. શક્ષાતાનું દૂધ વહેલું આપવાનું ચાલુ કરવાથી ગર્ભાશય જલ્દીથી નાનું થવા માંડે છે અને મૂળ સ્થિતિમાં જલ્દી આવે છે. તેથી માતાને લોહી વહેતું બંધ થવામાં મદદરૂપ થાય છે.

બાળકને એકબાજુના સ્તનમાંથી પૂરેપુરું ધાવણ લઈ લેવા દો. બાળક ધાવવાનું શક્ષ કરે તે પછી થોડીવારમાં (પાછળથી) આવતા દૂધમાં ચરણીનું પ્રમાણ વધુ હોવાથી તેને વધુ શક્તિ મળે છે. તેથી એક બાજુ પૂરેપુરું ધાવણ લઈને બાળક છોડી દે પછી જ તેને બીજું બાજુ આપો.

બાળકને વારાફરતી બંને સ્તન પર દૂધ આપવું જોઈએ. બાળક જેટલું વધુ ધાવે તેટલું માતાને વધુ દૂધ આવે છે. બાળકને છ ભાસ સુધી ફક્ત માતાના દૂધ સિવાય કોઈ પણ ખોરાક કે ઉપરનું દૂધ આપવું નહીં, કારણે તેનાથી બાળક ઓછું ધાવે છે અને માતાનું દૂધ પણ ઓછું થવા લાગે છે. વળી બહારથી અપાતા ખોરાકમાં ચોખ્ખાઈ ન જળવવાથી બાળકને જાડા થઈ જય છે.

રાત્રે સૂતી વખતે બાળકને માતાની પાસે જ રાખવાથી બાળકને ધાવણ આપવાનું સુગમ પડે છે.

## સ્તનપાન



બાળકને ધાવણ લેતી વખતે પેટમાં હવા જવાથી ધાવ્યા બાદ પેટમાં અમળાય છે ને દુઃખે છે. તેથી ધાવણ આપ્યા બાદ તેને ખભા પર અથવા છાતી પર લઈને થપથપાવો. તેથી તેના પેટમાં રહેલી હવા ઓડકાર વાટે બહાર નીકળી જશે અને તે શાંત થઈ જશે.



### સ્તનપાન વખતે બાળકને કેવી રીતે પકડશો.

બાળકને ધાવણ આપવા માટે તમારી ખૂબ નજીક રાખો અને બાળકની છાતી તમારી છાતીને અડકેલી રાખો. તેની દાઢી તમારા સ્તનને અડકવી જોઈએ.

માતા ટકાર બેસે.



જરૂર પડે તો બાળકને ઓશિંકું કુપડાનો વીઠો મૂકીને ટેકો આપો.

સાચી રીત



બાળકના મોમાં આખી ડીટડી આવે તેવી રીતે ધાવણ આપો.

બાળકનું માથું થોડું ઉંચું રાખવા હાથથી ટેકો આપો પણ તેનું શરીર અને માથું સુધી રેખામાં હોવા જોઈએ.



નવા જન્મેલા બાળકને નીચે સુધી પકડીને ટેકો આપો.

ખોટી રીત



આ બાળક ડીટડીના અગ્રભાગને જ મોમાં લઈ ધાવણ લે છે તે બરાબર નથી.

માતાને ધાવણ આપવામાં મુશ્કેલી હોય તો પણ ધાવણ આપવાનો પ્રયત્ન ચાલુ જ રાખો. જરૂર પડે વધુ અનુભવી બેનોની સલાહ લો.

### ૩.૦ માતાને આપવાના ખોરાક માટે સલાહ

ધાવણ આપતી માતાને વધુ શક્તિ (કેલરી) વાળો ખોરાક એટલે કે રોન્ઝિંદો ખોરાક વધારે પ્રમાણમાં આપવો. આ સમયે તેને કઠોળ, શાકભાજુ અને ઋતુ પ્રમાણે ફળ આપવા જેઠાએ.



કેટલાક લોકો માને છે કે માતાએ લીલા શાકભાજુ કે કઠોળ ના ખાવા જેઠાએ, કારણ તેનાથી બાળકને શરદી, વરાધ કે ઝાડા જેવા રોગ લાગે છે. આ માન્યતા ખોટી છે. આ સમય દરમ્યાન માતા જેટલા પ્રમાણમાં શાકભાજુ, કઠોળ, વગેરે ખાશે તેટલું જ તેનું દૂધ સારી રીતે બનશે. આવો સમતોલ ખોરાક ન મળવાથી તેને કુપોષણ, પાંડુરોગ કે બીજુ બિમારીઓ લાગે છે.

વળી માતાને પૂરતો અને યોગ્ય ખોરાક ન મળે તો પણ માતાનું શરીર પૂરતું દૂધ બનાવે છે. તેને લીધે તેનું શરીર વધુને વધુ ઘસારો ભોગવે છે. આ ઘસારો કાયમી ખોટ ન બની જય તે માટે માતાએ પૂરતું ખાવું જ જેઠાએ.

### ૪.૦ માતાને કામે જવાનું હોય ત્યારે

જે તમે ઘર બહાર કામ કરતા હો તો

- \* બને ત્યાં સુધી બાળકને તમારી સાથે લઈ જાઓ.
- \* જે તમારા કામના સ્થળની નજીક ઘોડિયાધર હોય તો બાળકને ત્યાં જ રાખો. વચ્ચે વચ્ચે સમય કાઢી બાળકને ઘોડિયાધરમાં જઈ ધાવણ આપો.
- \* શક્ય હોય તો દર બે-ત્રણ કલાકે બાળકને લઈને કોઈ તમારી પાસે આવે તેવું ગોઠવો.
- \* તમારા ઉપરી અધિકારી સાથે ચર્ચા કરી તમારા બાળકને છ માસ સુધી તમે ધાવણ પર રાખી શકો તેવી વ્યવસ્થા ગોઠવવાનો પ્રયત્ન કરો.
- \* ધણીવાર બાળક માતાનું ધાવણ લઈ ના શકે તેવા સંનેંગો હોય છે. ત્યારે આ બાળકને માટે માતા પોતાના સ્તનમાંથી દૂધ કાઢીને મોકલાવી શકે છે.




બાળકને ધાવણ આપી શકે તે માટે માતાના કામના/નોકરીના સ્થળે ઘોડિયાધરની વ્યવસ્થા હોવી જરૂરી છે.



બીજુ વ્યક્તિ બાળકને આ દૂધ પીવડાવી શકે. ઘણીવાર માતાના સ્તરનમાં ભરાવો થઈ જય અને બાળક ઘણી ન શકે ત્યારે માતા જાતે સ્તરનમાંથી દૂધ કાઢીને મૂકી રાખી શકે છે. દૂધ કાઢીને તેને હંડકવાળી જગાએ મૂકી રાખ્યાં તો લગભગ ૮-૧૦ કલાક સુધી તે એવું ને એવું રહેશે. માટીના વાસણમાં પાણી ભરીને તેમાં દૂધનો ગ્લાસ, વાડકી કે બોટલ મૂકી રાખો. અથવા કોઈ વાસણમાં ભીની રેતી ભરીને તેમાં આ દૂધ મૂકી રાખો. રેફિનેચેટરમાં મૂકેલું દૂધ ૨-૩ દિવસ સુધી સારું રહે છે. બાળકને આપતી વખતે આ દૂધને બરાબર હલાવીને મલાઈ બરાબર મીકસ કરો. પછી તેને ઉકાળીને હંડુ પાડ્યા પછી બાળકને પીવડાવો.

#### \* સ્તરનમાંથી દૂધ કાઢવાની રીત :

૧. એક પહોળા મોઢાની બોટલ કે બરણી અને તેનું ટાંકણ સાબુ અને પાણીથી એકદમ ચોખ્યું ધોઈ નાંખો. તેને તડકે સૂક્વીને રાખો. તેમાં દૂધ ભરતાં પહેલાં ઉકાળતા પાણીથી બરાબર ફરી ધોઈ નાંખો.
૨. તમારા હાથ પણ એવી જ રીતે બરાબર ધોઈ નાંખો.
૩. એક જગ્યાએ શાંતિથી બેસીને તમારા બાળકનો વિચાર કરતાં કરતાં તમારા હાથ/આંગણીઓ વડે, સ્તરને ડીટરી તરફ માલિસ કરો.
૪. ડીટરીના કાળાભાગ ને આંગણી અને અંગૂઠા વડે છાતી તરફ દખાવતા આપોઆપ દૂધ બહાર આવશે જે પેલી સાફ્ કરી રાખેલી બરણીમાં જીતી લેવું.
૫. શરૂઆતમાં પૂરતું દૂધ ના આવે તો પણ પ્રેક્ટીસ ચાલુ રાખવાથી દૂધ બરાબર આવવા લાગશે. બાળકથી અતિગ રહેવાનો પ્રસંગ આવે તે પહેલાંથી પ્રેક્ટીસ કરશો તો પૂરતું દૂધ જરૂર આવશે.
૬. આજકાલ સ્તરનમાંથી દૂધ કાઢવા માટે બ્રેસ્ટ પર્મ્પ પણ મળે છે. તેનો ઉપયોગ કરતી વખતે પણ તેની સફાઈની વાત બરાબર ધ્યાનમાં લેવી. ખાલી સાફ્ કરેલી બોટલને ગરમ કરી સ્તરનપર કાળા ભાગની આસપાસ ચૂસ્ત રીતે ચોંટાડી લેશો તો એ જ્યારે હંડી પડશે ત્યારે આપોઆપ સ્તરનમાંથી દૂધ ખેંચાઈને બહાર આવશે. તમે પ્રયત્ન કરીને તમને અનુકૂળ રીત અપનાવી શકો છો.



#### પ.૦ ધાવણ વિશે સાચું-ખોટું સમજુએ.

##### પ.૧ ધાવણ અંગેની કેટલીક માન્યતાઓ :

- \* ધાણી સ્વીઓને ધાવણ આપતી હોય ત્યાં સુધી ફરી ગર્ભ રહેતો નથી. પરંતુ ધાણી સ્વીઓ માટે આ વાત સાચી નથી. તેથી છ માસ પછી તરત બીજી વાર ગર્ભ ન રહી જાય તેની કાળજી લેવા માટે ગર્ભનિરોધની બીજી પદ્ધતિઓ વાપરો.
- \* ધાણીવાર સ્વીને એમ લાગે છે કે તેને ધાવણ ઓછું આવે છે. જે બાળક ૪-૬ માસથી નાનું હોય તો તેને ઉપરનું દૂધ આપવાને બહલે માતાએ બાળકને વારંવાર સ્તન પર લેવાનો પ્રયત્ન કરવો જેઠાં બાળક જેટલું વધારે ધાવશો તેટલું ધાવણ વધુ બનશે. આમ પાંચ-છ દિવસ સુધી પૂરતો પ્રયત્ન કરવા છિતાં બાળક રડયા કરે તો જ તેને ઉપરનું દૂધ કે અન્ય ખોરાક આપો.
- \* બાળકને છ માસથી ઉપરના ખોરાકની જરૂર પડે છે. તેથી તેને ખાવાનું શીખવાડવા માટે ચોથા કે પાંચમાં માસથી ખોરાક ચખાડવાની શરૂઆત કરી શકાય. આનાથી બાળક ધાવણ સિવાય બીજી સ્વાદથી ટેવાવા લાગશે અને છઠા માસથી તેની જરૂરિયાત મુજબ ઉપરનો ખોરાક તમે સફળતાથી આપી શકશો. બાળકને જાડા ના થાય તે માટે પૂરતી કાળજી રાખવી.
- \* બાળકને બજીરમાં મળતા તૈયાર ડબ્બાના ખોરાકની બિલ્કુલ જરૂર નથી. તેનાં કરતાં ઘરે બનાવેલો તાજે ખોરાક બાળકને વધુ તંદુરસ્તી આપનારો છે. માટે બાળકને તમારા ઘરમાં બનતો રોઝિંદો ખોરાક પોચો કરીને, હાથ સાખુથી બરાબર ધોઈને ખવડાવો.
- \* ખોરાકની સાથે તમારું ધાવણ બાળકને લગભગ હોઠ થી ૨ વર્ષનું થાય ત્યાં સુધી ચાલુ રાખો. બાળક બે વર્ષનું થાય ત્યાં સુધી ફરી મહિના ન રહે તે માટે ગર્ભનિરોધના સાધનો જરૂર વાપરો. તેથી પ્રથમ બાળકને પોષણની ખોટ ન પડે અને તમારા શરીરને ઘસારો પૂરો કરી બીજી તંદુરસ્ત સગર્ભાવસ્થા માટે તૈયાર થવાનો સમય મળે.

##### પ.૨ ધાવણ અંગેની સામાન્ય સમસ્યાઓ.

માતાને લાગે કે ધાવણ અપૂરતું છે એ વાત ખોટી છે.

સામાન્ય રીતે દરેક માતાને બાળક માટે કુદરતી રીતે જ પૂરતું દૂધ આવે છે. માતાના સ્તન નાના હોય તો દૂધ ઓછું આવે છે તેવી માન્યતા ખોટી છે. બાળકને વારંવાર સ્તન પર લેવામાં આવે તો તેને પૂરતું દૂધ આવે જ

ઘરમાં બનતો બધો ખોરાક બરાબર પોચો કરીને તેમાં તેલ/ધી અને ગોળ/ખાંડ નાંખીને બાળકને વાડકી-ચમચીથી ખવડાવવાની ટેવ પાડો.




છે. વળી, જો બાળક સક્રિય હોય, તેનું વજન વધતું હોય, પાંચ-છ વાર પેશાબ જતું હોય અને બે-ત્રણ વાર સંડાસ જતું હોય તો તેનો અર્થ છે કે બાળકને પૂરતું દૂધ મળી રહે છે. માતાનું દૂધ બાળકને માટે હંમેશા આરોગ્યપ્રદ હોય છે.

ધાવણ બીજા દૂધ કરતાં જુદું દેખાય છે તેથી ધણી સ્ત્રીઓ માને છે કે ધાવણ બાળકને પૂરતું પોષણ આપે તેવું નથી. પણ આ માન્યતા તફન ખોટી છે. બાળકને જેવું જેઠાં તેવું દૂધ માતાનું શરીર બનાવે છે. જે સ્ત્રીના બાળકો વારંવાર બિમાર પડતા હોય અથવા મરી જતા હોય તે સ્ત્રીનું ધાવણ ખરાબ છે તેવું સમાજ અને માતા બંને માને છે. તે વાત પણ ખોટી છે. કુદરતી રીતે માતાનું ધાવણ બાળક માટે આદર્શ ખોરાક છે. બાળક જે વારંવાર બિમાર થતું હોય તો તેની તબીબી સારવાર કરાવવાની જરૂર છે, તે માટે માતાને કે તેના ધાવણને કયારેય જવાબદાર ગણવા જેઠાં નહિ.



#### ડીટીના પ્રશ્નો :

દ્વારાયેલી ડીટી કે અંદર ઝેંચાયેલી ડીટી અંગે બહુ ચિંતા કરવાની જરૂર નથી. બાળક ધાવણ લેવા માટે ફક્ત ડીટી જ મૌંભા નથી લેતું. તે સ્તનના આખા આગળના ભાગને (શ્યામ ભાગને) મૌંભાં લઈ ચૂસે છે. તેથી મોટે ભાગે કોઈ તકલીફ થતી નથી. છતાં નીચેના સૂચનો ધ્યાનમાં લેવાથી થોડી સરળતા થઈ શકે.



#### સૂચનો :

- \* જન્મ પછી તરત જ ધાવણ આપવાનું શરૂ કરો. તે માટે સ્તન ભરાય તેની રાહ ન જુઓ. સ્તનનો આખો કાળો ભાગ બાળકના મૌંભાં આવે તે રીતે બાળકને સ્તનપાન કરાવો.
- \* જો દૂધને કારણે સ્તન વધારે ભરાઈ જય તો થોડું દૂધ બહાર કાઢ્યા પછી બાળકને સ્તનપાન કરાવો.

- \* ધાવણ આપતાં પહેલાં ડીટડીને સાધારણ ફેરવો તેને દૃબાવવાની કે જેંચવાની જરૂર નથી.
- \* સ્તનને તમારા હાથમાં પકડી છાતી તરફ જરાક દૃબાવો જેથી ડીટડી સાધારણ ઉપરી આવશે.



ડીટડી પર ચીરા પડવા :

જે ધાવણ આપતી વખતે તમને દુઃખાવો થાય તો શક્ય છે કે બાળક ફક્ત ડીટડી જ મૌખાં લે છે. જે તે ફક્ત ડીટડીથી જ ધાવણ લેશો તો ડીટડી પર ચીરા પડી શકે છે. ચીરા પડવાથી સ્તનમાં ચેપ લાગે છે અને ગૂમડાં જેવું થઈ જય છે. તેથી તમારે તબીબી સારવારની તાત્કાલિક જરૂર પડે છે.

ચીરા પડતા અટકાવવા માટે :

- \* ધાવણ લેતા અને બાળકના મૌખાંથી સ્તન છોડાવવા માટે જેંચી ના લો. બાળક પોતે જ પૂરતું ધાવણ લીધા પછી સ્તન છોડી દેશે. પરંતુ વચ્ચે તમારે ઉઠવાની જરૂર પડે તો ધીમે રહીને તેનું મૌખાંનીને સ્તન છોડાવો.
- \* બરછિટ અને ચૂસ્ત (ટાઇટ, ફિટોફિટ) કપડા ના પહેરો.
- \* ચીરા પડ્યા હોય તો સ્તનને હવા અને તડકો લાગે તેમ થોડીવાર ખૂલ્લાં રહેવા દો.
- \* એકબાજુ ચીરા પડ્યા હોય તો બીજુ બાજુ પહેલા ધાવણ આપો. બંને સ્તન પર ચીરા પડ્યા હોય તો જે બાજુ ઓછું દુઃખતું હોય ત્યાં પહેલું ધાવણ આપો પછી બીજુ બાજુ બાળકને લો. જે બહુ જ દુઃખાવો થતો હોય તો સ્તનને દૃદ્ધ વાડકીમાં લઈ બાળકને પીવડાવો.
- \* ડીટડી પર વારંવાર સાબૂ કે કીમ લગાવવાની જરૂર નથી. જરૂર પડ્યે બે ચાર ટીપાં ધાવણ લઈને ડીટડી પર લગાવવું. ચીરા બે દિવસમાં ઢાંબાવા જેઠાયો.



છાતી ઉલ્લાસ જવી :

જ્યારે દૂધ આવવા માંડે છે ત્યારે સ્તનમાં ભરાવો થાય છે અને કઠણા થઈ જય છે તેનાથી દુઃખાવો થાય છે. ધણીવાર બાળક બરાબર ચૂસી શકતું પણ નથી. બાળક બરાબર ચૂસી ના શકે અને દૂધ તો બન્યા જ કરે તેથી સ્તન ભરાઈ જય, ખૂબ દુઃખાવો થાય અને દુઃખાવાને કારણે સ્વી બાળકને ચૂસવા ન હે એમ પણ બને. આવું અટકાવવા માટે :

- \* બાળજન્મ પછી તરત બાળકને ધવડાવવાનું શરૂ કરો.
- \* બાળકને અવાર નવાર ધાવણ આપો. અનુકૂળતા મુજબ ૧ થી ૩ કલાકનો ગાળો રાખી શકાય.

## સ્તનપાન

- \* બાળક ધાવી ન શકે તો થોડું દૂધ હાથથી કાઢો અને બાળકને ચમચી વડે પીવડાવો. તેથી સ્તન થોડાક ઢીલા થશો અને હવે બાળક સારી રીતે ધાવણ ચૂસી શકશે.
- \* બે-ત્રણ દિવસમાં સ્તનમાં ભરાવો ઓછો થઈ જવો જેઠાં નહીં તો તેમાં પાક થવાની શક્યતા પૂરેપૂરી છે.

**છાતી પાકી જવી (સ્તનમાં પાક થવો) :**

સ્તનમાં રહેલી અનેક દૂધ વાહિનીઓમાં દૂધ જમી જવાથી આવી તકલીફ થાય છે. જે કોઈ ખીને તાવ આવે અને સ્તનમાં સોંને હોય, દુઃખાવો હોય અને તે ભાગ-ગરમ લાગે તો તેને સારવારની જરૂર પડે છે. બાળકને દૂધ આપવાનું ચાલુ જ રાખવું જેઠાં

**સારવાર :**

- \* ગરમ પાણીથી ભીનું કરેલ કપડું સ્તન પર રાખો.
- \* બાળકને શક્ય તેટલું વધુ ધાવણ આપો.
- \* બાળક ધાવતું હોય ત્યારે સ્તનના જે ભાગમાં કઠણ ગાંઠ જેવું લાગતું હોય તેની ઉપર ડીટડી તરફ હળવા હાથે માલીશ કરો. આથી ભરાવો ઓછો થવામાં મદદ થશે.
- \* ધાવણ લેવાની બાળકની સ્થિતિ બદલ્યા કરો. સ્તનના દરેક ભાગમાંથી ધાવણ વહ્યા કરશો તો જ દૂધ વાહિનીઓમાં જમેલું દૂધ છૂટું થશે.
- \* જે ૨૪ કલાકમાં ફેર ના પડે તો ડૉક્ટરની દવા કરવી પડશે.



સૌથી અગત્યનું એ છે કે ધાવણ આપવાનું ચાલુ જ રાખો. (વારંવાર આપો) દવાઓ અને આરામની પણ એટલી જ જરૂર છે. ફૂલેલા સ્તનમાંથી હાથ વડે દૂધ કાઢીને બાળકને આપો.

**સ્તનમાં ચેપની દવાઓ :**

પાક સૂક્વી નાંખવા માટે જીવાળું વિરોધી દવા લેવી, જેમ કે, એમોકસીસીલીન ૫૦૦ મિગ્રા. ની ગોળી દિવસમાં ઉ વખત, ૭ થી ૧૦ દિવસ સુધી અથવા ઈરીથ્રોમાઇસીન ૫૦૦ મિગ્રા. ની ગોળી દિવસમાં ઉ વખત, ૧૦ દિવસ સુધી લેવી.

તાવ અને દુઃખાવા માટે પેરાસીટામોલની ૫૦૦ મિ.ગ્રા. વાળી ગોળી જરૂર પડે ત્યાં સુધી લેવી.



### અગત્યનું :

સ્તનનો ચેપ વહેલામાં વહેલી તકે મટાડવો જોઈએ. જે દવા લેતાં પહેલાં કે દવા લેતા હોય તે દરમ્યાન ગરમ અને દુઃખતા ભાગમાં પ્રવાહી ભરાયું હોય તેમ જણાય તો ચીરો મૂકાવી પાક કઢાવવા તરત જ ડૉક્ટર પાસે જવું.

### ડીંટડી પર ફૂગ લાગવી. :

ઘણીવાર નાના બાળકના મૌંભાં થૂલો (ફૂગ) થાય છે તેથી બાળક જ્યારે ધાવણ લે છે ત્યારે માતાને ડીંટડી પર પણ તે લાગે છે. જે બાળક ધવડાવતી વખતે માતાને ડીંટડી અને ત્યાંથી સ્તનમાં બળતરા જેવો દુઃખવો થાય તો એ ફૂગ હોઈ શકે છે. ખંજવાળ આવે, ડીંટડીથી શરૂ થઈ આખા સ્તનમાં દુઃખવો જય, ડીંટડી પર સફેદ કે લાલ ચકામા થાય અને અથું જ બાળકના મૌંભાં પણ થયું હોય તો તે થૂલો (ફૂગ) છે.

### સારવાર :

જેન્શન વાયોલેટ (0.25%) નું દ્રાવણ (ભૂરી દવા) ડીંટડી પર અને બાળકના મૌંભાં લગાવો. ૩-૫ દિવસ સુધી દરરોજ ૧-૨ વાર આ દવા લગાવો. તેનાથી બાળકને કે તમને કોઈ જ નુકસાન નથી. દવાને લીધે ભૂરો રંગ લાગે તેની ચિંતા ના કરશો.

### ૬.૦ ખાસ પરિસ્થિતિઓ

**નાનું બાળક :** જ્યારે દોઢ કિલો (૧.૫૦૦ કિ.ગ્રા.) થી ઓછા વજનવાળું બાળક જન્મે ત્યારે તેને વિરોષ સારવારની જરૂર હોય છે. ઘણીવાર આ બાળકને ધાવતાં નથી ફાવતું. ત્યારે તેને ધાવણ આપવાનો પ્રયત્ન તો ચાલુ જ રાખવો પરંતુ છાતીમાંથી હાથ વડે ધાવણ કાઢી લઈને આવા બાળકને આપી શકાય.



**અધૂરા માસે જન્મેલું બાળક :** આવા બાળકને શરીરનો ગરમાવો ટકાવી રાખવા માતાના શરીરની હુંક આપવી જરૂરી છે. તેને માતાની છાતી સાથે વળગાડીને કબજની અંદર જ રાત-દિવસ રાખો. જરાક ઢીલો કબજને કે સ્વેટર પહેરવાથી આ બાબતે સુગમતા રહેશે. ઘણી જગ્યાએ આને “કાંગાડુ જેવી કાળજી” કહેવામાં આવે છે. આવા બાળકને વારંવાર ધવડાવવાની પણ જરૂર છે. બાળક જો ધાવણ બરાબર રીતે ચૂસી ના શકતું હોય તો ઉપર મુજબ ધાવણ કાઢીને આપવું જોઈએ.

**કપાયેલો હોઠ કે કપાયેલું તાળવું :** આવી ખોડ લઈને જન્મેલા બાળકની અત્યંત કાળજી લેવી જરૂરી છે. આવા બાળકને ધાવણ ચૂસતાં નથી ફાવતું. તેના કપાયેલા હોઠની જગ્યાએ આંગળી

રાખવાથી તેને ચૂસવાનું સહેલું પડશે. જે બાળકનું તાળવું પણ ફાટેલું હોય તો બાળક સીધું-ઉભું રહે તેવી સ્થિતિમાં તેને ધાવણ આપો. ઘણીવાર હાથેથી કાઢેલ ધાવણ પણ તેને અલગથી આપી શકાય.


**કમળાવાળું બાળક :** જે બાળકને જન્મ પછી તરત ખૂબ કમળો થઈ જય તેને કમળો મટાડવા સૂર્યના તહકાની અને માતાના ધાવણની ખાસ જરૂર છે. જે બાળક ખૂબ ઉંઘમાં જ રહેતું હોય તો પણ તેને ધાવણ આપવું જોઈએ. જે ઘેનને લીધે બાળક ચૂસતું ન હોય તો તેને હાથવડે કાઢેલું દૂધ પીવડાવવું. દિવસ-રાત થઈને લગભગ ૧૦ વાર તેણે પૂરતું ધાવણ લેવું જોઈએ. જે આ બાળક વધુ વાર ઉંઘ્યા જ કરે તો એને જગાડીને પણ ધાવણ આપો. ઇતાંય તે ખૂબ ઉંઘ્યા જ કરતું હોય તો તેને ડૉક્ટર પાસે લઈ જવું જરૂરી છે.



**જેડિયા બાળકો :** જ્યારે જેડિયા બાળકો જન્મ્યા હોય ત્યારે બન્નેને પૂરતા ધાવણની ખાસ જરૂર હોય છે. આવા સમયે માતાએ પૂરા આત્મવિશ્વાસથી બન્નેને ધવડાવવા જોઈએ. કારણ કે તે બાળકો માટે માતાના શરીરમાં પૂરતું દૂધ તૈયાર થાય છે જ.

### જ્યારે બાળક માંદું હોય ત્યારે :

જ્યારે બાળક માંદું હોય ત્યારે તેને ધાવણની ખાસ જરૂર હોય છે. માંદા બાળકને રોગ સામે લડવાની શક્તિ ધાવણમાંથી જ મળે છે. માટે તેનું ધાવણ કયારે ય બંધ ના કરવું.



બાળકને જાડા થયા હોય ત્યારે તેના શરીરમાંથી પાણી ખૂબ વહી જય છે. તેથી તેને ધાવણ આપવું અત્યંત જરૂરી છે. વળી તેને નિર્જલીકરણ ન થાય તે માટે ખાંડ-મીઠાનું શરબત પણ ચાલુ જ રાખવું જોઈએ, નહીં તો બાળકનું મરણ પણ થઈ શકે છે.

બાળકને ખૂબ ઉલ્ટીઓ થતી હોય તો પણ તેને થોડું થોડું ધાવણ વારંવાર આપ્યા કરવું જોઈએ. વરચ્યે વરચ્યે ખાંડ-મીઠાનું શરબત પણ આપવું જોશી તેને નિર્જલીકરણનો ભય ન રહે. ઉલ્ટીઓ બંધ ના થાય તો આરોગ્ય રક્ષક કે ડૉક્ટરની સલાહ લેવી.

બાળકને હુંમેશાં વાડકી-ચમચીથી ઉપરનું દૂધ આપો.

સૌથી પહેલા વાડકી અને ચમચી બંનેને સાબુ અને ચોખ્ખા પાણીથી સાફ કરી તડકે સૂકાવા દેવા. ત્યાર બાદ વાડકીમાં દૂધ લઈ ચમચી વડે પીવડાવો. બાળકનું માથું ચિત્રમાં બતાવ્યા મુજબ થોડુંક ઊંચું રાખો. ચમચીની નીચેની સપાટી બાળકના નીચલા હોઠને ધીમેથી અડકાડો અને ધીમે ધીમે ચમચીમાંથી દૂધ તેના મૌંભાં જવા દો. બાળક ખૂબ નાનું હોય તો ખૂબ ધીમે ધીમે, ટીપે ટીપે તેને દૂધ આપવું. જે વાડકીથી પી શકે એમ હોય તો વાડકીની ધાર તેના નીચલા હોઠ પર લગાડો અને ઉપલા હોઠને તેની બીજીધાર લગાડો, અને દૂધ ધીમે ધીમે પીવડાવો. વાડકી અને ચમચી ખૂબ ધારદાર ના હોય તેની ખાસ કાળજ રાખો. બાળકના મૌંભાં દૂધ ઠાતવવાની જરૂર નથી. પહેલેથી જ તેને પોતાની જાતે વાડકી કે ચમચીમાંથી ધીમે ધીમે દૂધ લેવા દો.



જ્યારે માતા બિમાર હોય ત્યારે :

જે તે બાળકને ધવડાવી શકે એમ હોય તો ધાવણ ચાલુ રાખો. માતાને ખૂબ તાવ આવતો હોય અને બહુ પરસેવો થતો હોય કે ઝાડા-ઉલ્ટીથી તેના શરીરનું પાણી નીકળી જતું હોય તો માતાને ખાંડ-મીઠાનું શરબત અને અન્ય પ્રવાહી ખોરાક વધુ આપવો. સૂતા સૂતા બાળકને ધાવણ આપવું પડે તો તેનું માથું જરા ઊંચું રાખો. જેથી ધાવણ તેના કાનમાં ના જથુ. માતાને ટીબી કે ખાંસી શરદી, વરાધ જેવા શ્વાસના રોગ હોય તો પોતાના મૌંભ પર ઝમાલ રાખીને બાળકને ધાવણ આપવું જેથી માતાનો શ્વાસ સીધે સીધો બાળકના શરીરમાં ના જથુ.



જ્યારે માતાને દવા લેવાની જરૂર પડે ત્યારે :

મોટાભાગની દવાઓ ધાવણ દ્વારા બાળકના શરીરમાં જઈ શકે છે. કેટલીક દવાઓ બાળક માટે નુકશાનકર્તા હોય છે. તે અંગે લીલા પાનાં પર માહિતી આપેલી છે. જ્યારે પણ ડૉક્ટર દવા આપે ત્યારે તેને પૂર્ણ લેવું કે ધાવણ દ્વારા તે દવા બાળકને નુકશાન કરશે ?

એચઆઈવી/એઈડસ હોય ત્યારે :

માતાને જ્યારે એઈડસ ના વિખાળું લાગ્યા હોય ત્યારે શું કરવું તે અંગે એઈડસના પ્રકરણમાં જુઓ.

જ્યારે માતાને ફરી મહિના રહે કે બાળક થાય ત્યારે :



ધાવણ આપતા હોય ત્યારે જે માતા સગર્ભા બને તો પ્રથમ બાળકનું ધાવણ તાત્કાલિક બંધ કરવાની જરૂર નથી. દરેક બાળકને ૧ વર્ષનું થાય ત્યાં સુધી તો ધાવણ મળવું જ જોઈએ. ધ્યાન રાખવાની બાબત એ છે કે સગર્ભાવસ્થા અને ધાવણ આપવા માટે માતાને અગાઉ કરતાં ઘણી વધારે શક્તિની જરૂર છે. માટે તેણે વધુ ખોરાક લેવો જોઈએ. પ્રથમ બાળકને જેમ જેમ મોટું થાય છે તેમ તેમ ઉપરનો ખોરાક આપતા જાઓ જેથી બીજું બાળક આવે ત્યાં સુધીમાં તેને ધાવણ પર આધાર રાખવાની જરૂર ના રહે.

એક બાળક ધાવતું હોય તે સમયે નવું બાળક અવતરે તો બંનેને ધાવણ આપવામાં કોઈ મુશ્કેલી નથી. એટલું ધ્યાન રાખો કે પહેલાં નાના બાળકને ધવડાવો અને પછી મોટા બાળકને ધાવણ આપવું.

ધાવણ આપવાથી માતાને ફાયદો થાય છે.

- \* સૂવાવડ વખતે મેલી છૂટી ના પડી હોય તો બાળકને તરત ધાવણ આપવાની કોશિશ કરો. બાળક સ્તન ચૂસશે તો ગર્ભાશયમાંથી મેલી છૂટી પડવામાં મદદ થશે.
- \* બાળક ધાવણ લેતું હોય તે દરમ્યાન માસિકમાં લોહી ઓછું પડે છે. તેથી એનિમિયાનો રોગ અટકાવે છે.
- \* જે માસિક આવતું ના હોય અને માતા બાળકને ફક્ત ધાવણ પર રાખે તો ૬ માસ સુધી ૮૮% બેનોને ફરી ગર્ભ રહેતો નથી. છ માસ પછી પણ કેટલીક બેનોને લાભ મળી શકે પરંતુ ભરોસો રાખી શકાય નહીં તેથી કુટુંબ નિયોજનના સાધનની જરૂર પડે છે.
- \* નાના બાળકને દરરોજ ૧ કિલો ગ્રામ વજન પર ૧૦૦ મી.લી. દૂધ જોઈએ છે. જે માતા બાળકને ફક્ત ધાવણ પર રાખે તો દરરોજ પૈસાની એટલી બચત થાય છે.
- \* માતા ફક્ત ધાવણ સિવાય બાળકને કશું જ ના આપે તો ધણા મહિના સુધી ઘણી માતાઓને માસિક આવતું નથી. એટલે સ્તનપાન કરાવતી માતાને એનિમિયા થતો અટકે છે.
- \* નિયમિત સ્તનપાન કરાવવાથી સ્તનમાં રસી થવાની સંભાવના ઓછી રહે અને લાંબા ગાળે કેન્સર થવાની શક્યતા પણ ઘટે છે.

- \* ધાવણમાં બાળકને રોગથી બચાવનાર તત્ત્વો પણ હોય છે તેથી નિયમિત સ્તનપાન કરતું બાળક બિમાર ઓછું પડે છે અને માતાને તથા કુટુંબને નાણાં ખર્ચમાંથી બચાવે છે.

### ૭.૦ પરિવર્તન માટે પ્રયાસ

આપણા સમાજમાં લગભગ દરેક માતા બાળકને ધાવણ આપવામાં માને જ છે. ઇતાં કેટલીક માતાઓને ધાણીવાર ધાવણ આપવામાં મુશ્કેલી હોય છે. આવી બેનોને મદદની ખાસ જરૂર છે. આરોગ્ય રક્ષક કે નર્સ આવી બેનો સાથે ધીરજપૂર્વક કામ કરી શકે છે. તેઓને જે ધાવણ નથી આવતું એવું લાગે તો તેમને વિશ્વાસ બંધાવો કે જે તેઓ પ્રયત્ન ચાલુ રાખશે તો તેમને જરૂર ધાવણ આવશે જ. ખાસ કરીને નવજાત શિશુને બને તેટલા વહેલા ધાવણ આપવાનું ચાલુ કરવું જોઈએ. પ્રથમ ધાવણ આવે તે ફેંકી ન દેવું. તે ધાવણમાં રહેલા પોષક તત્ત્વો બાળકને રોગ સામે લડવામા ખાસ મદદકૃપ છે. માટે તેઓને ખાસ શીખવો કે પ્રથમ ધાવણ આપવું, તે બાળકના હિતમાં છે. કોઈ પણ પ્રકારના ફૂત્રિમ દૂધ આપવા યોગ્ય નથી. માતાના ધાવણથી વધુ સારું પોષણ બાળકને માટે આ દુનિયામાં બીજું કોઈ નથી. માટે બજરણમાં મળતા ડબ્બાના દૂધના પ્રચારથી તમારી બેનોને દૂર રાખો. કોઈ પણ કંપની વાળા તમારા કેન્દ્ર પર પ્રચાર ના કરે તેની કાળજી રાખો. તેમના પોસ્ટર કે ચિત્રો ખૂબ સુંદર હોય ઇતાં તમારા કેન્દ્ર પર તેને લગાવવા ના દેશો.

માન્યતાઓને સુધારવાનું કામ કરો :

બાળકનું સ્વાસ્થ્ય જણવવા માટે માતાનું ધાવણ સૌથી સારું પોષણ આપે છે. આ વાતનો ભારતીય સંસ્કૃતિમાં સ્વીકાર હોવા ઇતાં માતા અને ધાવણ અંગે ધાણી અવૈજ્ઞાનિક માન્યતાઓ પણ પ્રચલિત છે.

જેમ કે,

- \* જે સ્ત્રીના બાળકો વારંવાર મરણ પામતા હોય તે સ્ત્રીનું ધાવણ ભારે છે અને તે બાળકને ઘવડાવી ના શકે. આ માન્યતા ખોટી છે. આવી સ્ત્રીને તબીબી સહાયની જરૂર છે. તેને ગર્ભ રહેતાં પહેલાં જ તબીબી સહાય આપો.
- \* માતા જે ખાય તેની અસર બાળકને થાય છે. તેથી માતાને ધાણી બધી વસ્તુઓનો નિષેધ (પરહેજ) રાખવા ફરજ પાડીએ



ઈથે. આ માન્યતા પણ ખોટી છે. બાળકને ધવડાવતી માતાને વધુ પોષણદાયક અને લીલા શાકભાજી, કઠોળ વાળો ખોરાક આપવો જેઠાંથે.

- \* ધાવણ આપવાથી માતાનું શરીર અગાઉના જેવું સુગઠિત અને સુંદર રહેતું નથી એવી માન્યતાને કારણે આપવો ત્યાં ધાણી બેનો બાળકને ધાવણ આપવાને બદલે બાધ્ય દૂધ તથા આહાર માટેના ડબ્બાઓનો ઉપયોગ કરે છે. આવું કરવાથી બાળકને માતાના દૂધમાં રહેલા રોગપ્રતિકારક તત્ત્વો પહોંચતા નથી, બહારના ડબ્બાનું દૂધ પૂરતા પ્રમાણમાં આપવા માટે ખૂબ ખર્ચ થાય છે. તે દૂધ પાવાના સાધનો-બાટલી, નિપલ વગેરે સારી રીતે સાફ નથી થઈ શકતા અને બાળક અવારનવાર બિમાર થઈ જય છે.
- \* કેટલાક લોકો (તબીબો અને સામાન્યજન) એવું માને છે કે બાળકને ધાવણ આપવાનું સૂચન ગરીબ લોકો માટે છે. જે લોકો પાસે પૈસા છે તેઓના બાળકોને તો બહારનું દૂધ, ડબ્બાના આહાર, વગેરે ઉપર ઉછેરવાથી બાળકો વધુ તંદુરસ્ત બને છે. આ માન્યતા બૂલભરેલી છે. ગરીબ કે પૈસાપાત્ર, બન્નેના બાળકો અને માતાઓ માટે ધાવણ અંગેની સૂચના એક સરખી જ છે. ઠીઠીયન એકડેમી ઓફ પીડીયા ટ્રીક્સ (બાળ રોગનિષ્ણાત તબીબો) દ્વારા “બ્રેસ્ટ-ફીડિંગ ઇઝ બેસ્ટ ફીડિંગ” ની જુંબેશ ધાણા વર્ષોથી ચલાવવામાં આવે છે અને તેઓ દ્વારા દૂધ અને ડબ્બા બનાવતી કંપનીઓ પર પણ દબાણ લાવવામાં આવેલ છે કે તેઓ ખોટો પ્રચાર બંધ કરે. આવા ડબ્બાઓ પર “માતાનું દૂધ (ધાવણ) બાળક માટે શ્રેષ્ઠ આહાર છે” તેવી નોંધ લખવાની ફરજ કાયદાકીય છે.



આવા ચિત્રો દિવાલ પર  
ના લટકાવશો.

આમ માતા અને બાળકને ખાસ સંબંધે બાંધી શકનાર કુદરતી પ્રક્રિયા અંગે શંકા-કુશંકાઓ ઉભી કરવાથી બન્નેનું સ્વાસ્થ્ય જોખમાય છે. તમે આવી માન્યતાની સામે કામ કરો અને તે દૂર થાય તેવો પ્રયત્ન કરો.

**ધાત્રી માતાને કામનો બોજે :**

ધાવણ આપતી માતાને જ્યારે કામનો બોજે ખૂબ હોય ત્યારે તે ઇચ્છે છે કે તેના બાળકને ઘરના અન્ય વડીલો કે પાડોશીઓ સાચવે. જે ઘરમાં આવો એકો માતાને નથી મળતો તે બેનો બાળક અંગે સતત ચિંતાતુર રહેવાથી પોતાનું કામ ભરાબર કરી શકતી નથી. તેની ચિંતાની અસર બાળક પર પણ થાય છે અને બન્નેનું સ્વાસ્થ્ય લોખમાય છે. તેથી ઘરના બધા વડીલો-પતિ, સાસુ, સસરા કે અન્ય-સૌની ફરજ છે કે તેઓ બાળકની સાચવણીમાં માતાને મદદ કરે.



ઘરમાં નવું બાળક આવે તે અત્યંત ખુશીનો પ્રસંગ છે. જે માતાને ઘરમાંથી સારો એકો મળે, તેનું કામ વહેંચનાર પતિ મળે તે માતા નવા બાળકનો ઉદ્ઘેર તથા ઘરની જવાબદારીઓ સારી રીતે ઉપાડી શકે છે.

### આરોગ્ય ચિંતક માટે

જો તમે આરોગ્ય કાર્યકર હો તો તમારા ક્ષેત્રમાં દરેક બાળકને જન્મના એક કલાક પહેલાં જ માતાનું ધાવણ મળે તે માટે પ્રયત્ન કરો તથા બાળક છ માસનું થાય ત્યાં સુધી માતાનું ધાવણ બાળકને નિરંતર મળતું રહે તે બાબત શિક્ષણ કરો. પ્રથમ છ માસ તો બાળકને ધાવણ સિવાય બીજું કશું જ આપવાની જરૂર નથી. તમે આટલું કરી શકો :

- (૧) બેનોને સગર્ભવિષ્ટથાથી જ માનસિક તૈયારી કરાવો કે તેમના બાળકને માટે તેમજું ધાવણ જ શ્રેષ્ઠ છે. માતાને આશ્વસ્ત કરો કે કોઈ પણ સંજોગોમાં તે પોતાના બાળકને જોઈએ છે તેટલું ધાવણ ઉત્પન્ન કરી જ શકશો. આ માટે ધાવણ આપતી અન્ય બેનો અને સગર્ભા સ્ત્રીઓની શિબિર કરો અને તેમને એકબીજા સાથે વાતચીતનો પૂરતો મોકો મળી રહે તેવું ગોઠવો.
- (૨) પ્રથમવાર સગર્ભ બનતી બેનોને તેમની પોતાની જરૂરિયાતો અંગે જાગ્રત કરો. ધાવણ આપતા હોય તે સમયે માતાએ બદી અંધશ્રદ્ધા અને ખોટી માન્યતાઓ ત્યાગીને લીલા શાકભાળુ, કઠોળ તથા અન્ય ખોરાક પૂરતા પ્રમાણમાં લેવો જોઈએ તે અંગે ખાસ શિક્ષણ કરવું. જો સાસુ કે ઘરના અન્ય લોકોની માન્યતાઓ બરાબર ના હોય તો તેમજું પણ સારી રીતે શિક્ષણ કરવું જરૂરી છે.
- (૩) કોઈપણ સંજોગોમાં બજારમાં મળતા ડબ્બાના દૂધ કે ખોરાક ધાવણનો વિકલ્પ નથી તે અંગે વાતચીત કરો.
- (૪) જો કોઈ માતાનું સુવાપડમાં કે ત્યાર પછી તરતના ગાળામાં મૃત્યુ થાય તો તેના અન્ય કોઈ સગા-વહાલા કે મિત્રના પતિનિને ધાવણ આવતું હોય તો તેઓ આ બાળકને છ માસ સુધી ધવડાવે તેવી વ્યવસ્થા કરી શકાય. જો આવું શક્ય ના હોય તો ગાય કે ભેંસનું દૂધ ઉકાળી, ખાંડવાળું કરીને વાડકી ચમચીથી બાળકને આપે તેવો આગ્રહ રાખો અને આ કુટુંબને તે માટે ટેકો આપો.

